

**B.R.S. Semester - 6 (CBCS) Examination**  
**March/April-2023 (OLD COURSE)**  
**C-22 HORTICULTURE & FORESTRY(CORE-22)**

Time: 2:00 Hours

Marks: 50

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(૧૦)

1. રીંગણાની જાતો પૂસા રાઉન્ડ, જુનાગઢ ઓબ્લોંગ, જુનાગઢ લાંબા, સુરતી રવૈયા, ગુજ.ગ્રીન ગોટા અને ગુજ.હા.રીંગણા-૧ ની સરખામણી કરવા માટે CRD મુજબ લેવાના પ્રયોગમાં દરેક માવજત માટે ચાર પુનઃરચના રાખવાની હોય તો માવજતોની યદ્યથ ફાળવણી કઈ રીતે કરશો તે મુદાસર આકૃતિ સાથે સમજાવી, આ રચનાનો સૈધાંતિક વિચરણ પૃથ્થકરણ કોઠો બનાવો.
2. એક દિશા તરફથી બીજી દિશા તરફ જતા જમીનની ફળદ્રુપતા વધતી જતી હોય તેવી પરિસ્થિતિમાં ભીંડાની નીચે મુજબની જાતોની સરખામણી કરવા માટે દરેક માવજત માટે ચાર પુનઃરચના રાખી એક ક્ષેત્રપ્રયોગ લેવાનો છે તો કઈ પ્રયોગ રચનાનો ઉપયોગ કરશો? આ પ્રયોગમાં માવજતની યદ્યથ ફાળવણી કઈ રીતે કરશો તે મુદાસર આકૃતિ સાથે સમજાવો. આ પ્રયોગના અંતે જાતોના સરેરાશ ઉત્પાદન નીચે મુજબ મળેલ છે, જો Error MS = 1.96 અને  $t_{0.05} = 2.131$  હોય તો બાર-ડાયાગ્રામ બનાવી અર્થઘટન લખો તેમજ CV % શોધો.

| રીંગણાની જાતો  | સરેરાશ ઉત્પાદન<br>(કિ.ગ્રા./ખંડ) |
|----------------|----------------------------------|
| જુનાગઢ ભીંડા-૨ | 18.9                             |
| પૂસા સાવની     | 13.5                             |
| પૂસા મખમલી     | 15.8                             |
| પરભણી કાંતિ    | 14.6                             |
| ગુજ.હા.ભીંડા-૧ | 17.2                             |

પ્રશ્ન-૨ નીચેના માંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(૧૦)

1. પ્રાયોગિક એકમોમાં બે દિશા તરફી ચલન હોય ત્યારે કઈ પ્રયોગ રચનાનો ઉપયોગ કરશો? આ પ્રયોગ રચનાના ગેરફાયદા જણાવી, આ રચના મુજબ છ માવજતની ચકાસણી કરવાની છે તો માવજતોની યદ્યથ ફાળવણી કઈ રીતે કરશો તે ઉદાહરણ દ્વારા આકૃતિ સાથે મુદાસર સમજાવો.
2. સંશોધન દરખાસ્ત લખવાની રીત મુદાસર સમજાવો.

પ્રશ્ન-૩ ટ્રેકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

(૧૫)

1. “ABBA” રીત
2. શૂન્ય ઉપકલ્પના
3. સ્વાતંત્ર્યની માત્રા
4. RBD અને CRD વચ્ચેના મુખ્ય તફાવતો
5. પ્રયોગની જવાબદારીની સોંપણી

પ્રશ્ન-૪ માગ્યા પ્રમાણે જવાબ આપો. (કોઈપણ પાંચ)

(૧૫)

(દાખલામાં ગણતરી દર્શાવવી આવશ્યક)

1. CRD માં પ્રયોગ રચનાના કયા પાયાના સિદ્ધાંતનો ઉપયોગ થતો નથી? શા માટે?
2. LSD માં જો સ્તંભની સંખ્યા=6, Error MS =150 હોય તો Error SS, Treat df અને Total df શોધો.
3. જો અવલોકનોનો કુલ સરવાળો (GT) = 180, સુધારક અવયવ (CF) =1800 અને Error MS = 16 હોય તો CV %, સામાન્ય સરેરાશ (GM) અને અવલોકનની કુલ સંખ્યા(n) કેટલી થશે?
4. જો Error MS = 16 અને SEM = 1 હોય તો પુનઃરચનાની સંખ્યા કેટલી થશે?
5. એક ક્ષેત્રપ્રયોગમાં ૨૦ મીટર લાંબા ખંડમાં બે હાર વચ્ચેનું અંતર ૬૦ સે.મિ. હોય તેવી કુલ ૧૫ હારો આવેલી છે તો ખંડના કુલ વિસ્તારના ક્ષેત્રફળની ગણતરી કરો.
6. ક્રાંતિક તફાવતની વ્યાખ્યા લખી તે શોધવાનું સૂત્ર લખો.
7. RBD માં Treat SS, Repl SS અને Error SS શોધવાના સુત્રો લખો.

\*\*\*\*\*